

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનને આંગણે વિશ્વને લાવવાની વ્યુહરચનાનો સીટી દ્વારા શુભારંભ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (29 મે 2019) – આજે સીટી ઓફ બ્રેમ્પટનનાં ઇકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચરનાં કાર્યાલયે વિશ્વ ફરતે આર્થિક કડીઓને વધુ મજબૂત બનાવીને બ્રેમ્પટનમાં રોજગાર અને વિકાસ ઉત્તરોત્તર વધારવાની યોજનાનું અનાવરણ કર્યું. લક્ષ્ય એ છે કે દુનિયા સામે નિદરશિત કરી શકાય કે બ્રેમ્પટન તકોનું શહેર છે.

બ્રેમ્પટનની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની વ્યુહરચના વિવિધ પ્રકારના મુખ્ય આર્થિક ક્ષેત્રોમાં શહેરની હાલની તાકાતોનો લાભ લઈને રોકાણ આકર્ષિત કરતી અસ્ક્યામતોના અલગ અલગ પ્રકારો ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે – જે છે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, લેથ એન્ડ લાઈફ સાયન્સિસ અને ઇનોવેશન તથા ટેકનોલોજી

સીટીની FDI યોજના સંખ્યાબંધ ભૌગોલિક ક્ષેત્રોમાં વૈવિધ્યસભર છે જેમકે યુએસ અને પશ્ચિમી યુરોપ જેવા આર્થિક રીતે સમાન બજારોથી લઈને ચીનમાં રહેલ લાંબા ગાળાની સંભાવનાઓ.

બ્રેમ્પટન પાસે વિશ્વને જાણાવવા જેવી આકર્ષક કથા છે. મુખ્ય પરિવહન નેટવર્ક્સથી નજીક હોય એવા પોતાના મોકાના સ્થળો ઉપરાંત સીટી નવો વ્યાપાર આકર્ષિત કરવા સંપત્તિઓને વિકસાવી રહ્યું છે. નવતર [સહકાર્ય કરવાનું સ્થળ](#) છે, [સાયબરસિક્કોર કેટાલિસ્ટ](#) છે અને રાયેરસન યુનિવર્સિટી, અલ્ગોમા યુનિવર્સિટી અને શેરિડાન કોલેજ સાથેની પોસ્ટ-સેકન્ડરી તકો છે.

મે 28ના રોજ, ઇકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર ઓફિસ બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ માટે એક બિઝનેસ બ્રેકફાસ્ટનાં યજમાન બન્યા જેથી FDIના અભિગમ અને નવા એમ્બેસેડર પ્રોગ્રામની ચર્ચા થઈ શકે. સંખ્યાબંધ સ્થાનિક વેપારી લોકો આ પ્રોગ્રામમાં સહભાગી થઈ રહ્યા છે જે સીટીની FDI વ્યુહરચના સાથે મેળ ખાય છે અને સ્થાનિક વ્યાપારોનું સશક્તિકરણ કરે છે કે બ્રેમ્પટન તેના વૈશ્વિક ભાગીદારો સામે પોતાના મૂલ્યનો પ્રસ્તાવ રજૂ કરી શકે.

આ વર્ષના પૂર્વાર્ધમાં બ્રેમ્પટન સીટી કાઉન્સિલે FDI વ્યુહરચના ને કાર્ય યોજનાનો અમલ કરવા માટે \$1.875 મિલિયનનું ઓપરેટિંગ કેપિટલ બજેટને બહાલી આપી. આગામી પગલાં તરીકે ઇકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર ઓફિસ આજના FDI વાતાવરણમાં સીટીના મૂલ્યને પરિભાષિત કરવામાં મદદરૂપ થવા એક માર્કેટિંગ ઝૂબેશ અને સ્ત્રોત સહાય વિકસાવશે તેમજ તે વ્યુહરચનાને અમલ કરવાની યોજના બનાવશે.

અવતરણો

"બ્રેમ્પટન ખાતે આ વ્યુહરચનાનો આરંભ કરતા હું બહુ રોમાંચિત છું. શહેરના ભવિષ્ય માટેનું આ રોકાણ છે. અમારે ટોચનાં ઉદ્યોગોને જાણાવવું છે કે જ્યારે તેઓ વિકાસ સાધવા, વિસ્તરણ કરવા અને નિવેશ કરવા બ્રેમ્પટન પર પસંદગી ઉતારે ત્યારે તેઓને અત્યંત કુશળ પ્રતિભાઓ, સ્પર્ધાત્મક ફાયદા અને વૈશ્વિક માર્કેટપ્લેસની સુગમતા મળી શકશે."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

"બ્રમ્પટન પોતાનું સ્થિતિ નિર્ધારણ એવી રીતે કરશે જેથી તેની પ્રોફાઇલ વૈશ્વિક માર્કેટપ્લેસમાં બળવાન અને અભિનવ બ્રાન્ડ વ્યુહરચનાથી વધુ મજબૂત બને જે વ્યાપાર, વિદેશી રોકાણ અને રોજગાર આકર્ષી શકે. સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય સ્તરે મુખ્ય ઉદ્યોગોમાં અપણો ડંકો વગાડવા માટે અમે રોમાંચિત છીએ."

- (રીજનલ કાઉન્સિલર) ગુરપ્રીત એસ ધિલ્લોન, ઇકોનોમિક ડેવેલપમેન્ટના પ્રમુખ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca